

શ્રીમતી એસ.આઇ.પટેલ હાજીવાલા કોલેજ ઓફ કોમર્સ -પેટલાદ

આંતરીક કસોટી બી.કોમ.સેમ-૧

એડવાન્સ એકાઉન્ટ & ઓડિટીંગ IV (UB02ECOM02)

તારીખ-૨૫-૦૨-૨૦૧૯

સમય -૦૮-૦૦ થી ૦૯-૦૦

માર્કસ-૩૦

પ્ર.૧ કિશ્ના લિમિટેડનું તા-૩૧-૦૩-૨૦૧૩ ના રોજનું પાકુંસરવૈયું નીચે મુજબ છે

૧૫

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઇક્વિટી શેરમૂડી દરેક રૂ.૧૦૦ નો પૂરા વસૂલ	૨૦૦૦૦૦	જમીન-મકાન	૧૫૦૦૦૦
૧૦%ની પ્રે.શેર મૂડી દરેક ૧૦ નો પૂરા વસૂલ	૬૦૦૦૦	યંત્રો	૧૦૦૦૦૦
સામાન્ય અનામત	૪૦૦૦૦	ચાલુ મિલકતો	૯૫૦૦૦
નફાનુકસાન ખાતું	૩૦૦૦૦	પ્રાથમિક ખર્ચ	૫૦૦૦
લેણદારો	૨૦૦૦૦		
સરવાળો	૩૫૦૦૦૦	સરવાળો	૩૫૦૦૦૦

વધારાની માહિતી-

(૧) જમીન-મકાન,યંત્રો તથાચાલુ મિલકતોની હાલની બજાર કિંમત અનુક્રમે રૂ.૨૦૦૦૦૦, રૂ.૮૦૦૦૦, અને રૂ.૯૦૦૦૦ છે. (૨) આ કંપનીના જવો ધંધો કરતી અને ૧૬% ડિવિડન્ડ આપતી કંપનીના ઇક્વિટી શેરનો બજાર ભાવ તેની વસુલ રકમ કરતા બે ઘણો છે.(૩) ૫૦% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાનો છેલ્લા ત્રણ વર્ષનો નફો અને ઉપયોગમાં લેવાનો યોગ્ય ભાર નીચે મુજબ છે.

વર્ષ	નફો રૂ.	ભાર
૧	૫૦૦૦૦	૧
૨	૫૭૫૦૦	૨
૩	૬૫૦૦૦	૩

ઉપરની માહિતી પરથી અધિક નફાની ૩ વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધો.

અથવા

પ્ર.૧ ટૂંક નોંધ લખો (ગમે તે એક )

૧૫

(૧) રોકાયેલી મૂડી (૨) પાઘડીને અસર કરતા પરિબળો (૩) શેર મૂલ્યાંકનને અસર કરતા પરિબળો

પ્ર.૨ કિર્તન કં. લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે

૧૫

દેવા	રૂ.	મિલકતો	રૂ.
અ પ્રકારના ઇ.શેર રૂ.૧૦ નો પૂર્ણભરપાઇ	૩૦૦૦૦૦	પાઘડી	૨૫૦૦૦
બ પ્રકારના ઇ.શેર રૂ.૧૦ નો ૮ ભરપાઇ	૨૦૦૦૦૦	જમીન-મકાન	૪૦૦૦૦૦
૧૨%ની પ્રેકરન્સ શેરમૂડી	૧૦૦૦૦૦	યંત્રો	૨૦૦૦૦૦
સામાન્ય અનામત	૨૫૦૦૦	ધંધાકિય રોકાણો	૫૦૦૦૦
૧૨%ના ડિવેન્ડર	૧૫૦૦૦૦	૧૦% ના બિનધંધાકિય રોકાણો	૧૦૦૦૦૦
પ્રોવિડન્ટફંડ	૨૫૦૦૦	ચાલુ મિલકતો	૨૦૦૦૦૦
અન્ય દેવા	૨૦૦૦૦૦	ડિવેન્ડર વટાવ	૨૫૦૦૦
	૧૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦

વધારાની માહિતી-

(૧) પાઘડીની કિંમત રૂ.૫૦૦૦૦ ગણવાની છે. (૨) અપેક્ષિત વળતરનો દર ૧૦% છે.કરવેરાનો દર ૫૦% છે.

(૩) છેલ્લા ત્રણ વર્ષનો કરવેરા પહેલાનો સરેરાશ નફો રૂ.૨૪૦૦૦૦ છે.

ઇક્વિટી શેરની આંતરીક અને બજાર કિંમતની ગણતરી કરો.